

## અગત્યની નોટિસ

૧. PIN મેળવવા માટે જે મોબાઇલ નંબર નો ઉપયોગ કર્યો હોય તેજ નંબર રજીસ્ટ્રેશન માટે વાપરવો. જેથી તેજ નંબર પર તમને એડમિશનને લગતા મેસેજ મળી શકે. મોબાઇલ નંબર બરાબર જોઈને સાચો ભરવો. છેક સુધી આ મોબાઇલ નંબર બદલાય નહિ તે ખાસ જોશો.
૨. પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પણે ઓનલાઇન છે. જેમાં PIN વિતરણ, રજીસ્ટ્રેશન, કોલેજ allotment & Reporting તથા વેરિફિકેશન નો સમાવેશ થાય છે.
૩. વિદ્યાર્થીઓએ ઓનલાઇન એડમિશન માટે અપલોડ કરેલ સર્ટિફિકેટ ખોટા જણાશે તો કોલેજ તેમનો પ્રવેશ રદ કરશે.
૪. માર્ક્સ ફક્ત બોર્ડ ની પરીક્ષા ના થીયરી પેપર ના જ હોવા જોઈએ (ઇન્ટરનલ પરીક્ષા ના માર્ક્સ/ પ્રેક્ટીકલ પરીક્ષા ના માર્ક્સ/ગ્રેસીંગ માર્ક્સ ગણતરી માં લેવા નહી) તથા આ માર્ક્સ ૧૦૦ માર્ક્સ માંથી મળેલા ના હોય તો તેને ૧૦૦ માર્ક્સ માંથી જેટલા થતા હોય તે પ્રમાણે convert કરવા.
૫. GSEB બોર્ડ સીવાય ના તમામ અન્ય બોર્ડ ના વિદ્યાર્થીઓ કે જેઓએ ગુજરાત રાજ્ય બહાર ની બહાર ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ હોય, તેઓ એ ગુજરાત યુનિવર્સિટી માંથી Provisional Eligibility Certificate મેળવી ને Registration વખતે અપલોડ કરવાનું રહેશે.
૬. વિદ્યાર્થીઓએ ઓનલાઇન એડમિશન પ્રક્રિયામાં માગેલ વિગત સાચી ભરવી. તથા કોલેજ તથા વિષયની પસંદગી ધ્યાનપૂર્વક કરવી. ઓછામાં ઓછા ૧૫ ગ્રૂપની (૧૫ કોલેજની નહીં) પસંદગી કરવી.
૭. વિદ્યાર્થીઓએ તેમણે મળેલ PIN, સિરિયલ નંબર, રજીસ્ટ્રેશન નંબર, બેન્ક ટ્રાન્ઝેક્શન નંબર કોઈને જણાવવા નહીં. પોતાની પાસે સાચવીને રાખવા.

૮. રાજ્યના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશની સમાન તક છે. તેઓ કયા જીલ્લાના છે તેનું કોઈ મહત્વ નથી.

૯. Registration ની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય પછી તમને મળતી University receipt માં નામ, Registration નંબર, સીરીયલ નંબર, PIN વગેરે વિગતો હશે, જે ખુબજ અગત્યની હોઈ તમે સાચવી રાખશો. અન્ય કોઈ સાથે તે share કરવા નહીં. (આ બાબતે માટે નો SMS તમને BGSOFTTECH તરફથી પણ મળશે)

૧૦. વિદ્યાર્થીએ માર્કશીટ તથા જે પ્રકાર ના સર્ટીફિકેટ (દસ્તાવેજો)ની જરૂર હોય તે તમામ સર્ટીફિકેટ (દસ્તાવેજો) ફરજિયાત ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. સર્ટીફિકેટ (દસ્તાવેજો) જમા કરાવવા કે વેરીફાઈ કરાવવા કોલેજ કે યુનિવર્સિટી ખાતે રૂબરૂ જવાનું રહેશે નહીં. વિદ્યાર્થીઓ ને ફાળવવા માં આવનારા પ્રવેશ પ્રોવિઝનલ ગણાશે કોઈ પણ તબક્કે રજૂ કરેલ સર્ટીફિકેટ (દસ્તાવેજો) ની સત્યતા બાબતે અથવા પ્રવેશ માટેની નિર્ધારિત લાયકાત અંગે કોઈ વિસંગતા ઉભી થશે તેવા સંજોગામાં પ્રવેશ રદ કરવા સહીત નો યુનિવર્સિટી નો નિર્ણય આખરી ગણાશે.

૧૧. ઓનલાઈન ફોર્મ ભરવામાં થતી મુંજવણો માટે હેલ્પલાઇન નંબર (બુકલેટ ના પેઈજ નં: ૫૦ થી ૫૩) ઉપર પૂછપરછ કરી સ્પષ્ટતા મેળવી લેવાની રહેશે.